

Seat No. : \_\_\_\_\_

# KH-105

March-2014

## M.A. Part – II (Annual Pattern)

### Paper - V (Main)

#### Sanskrit

કાદમ્બરી – કથામુખભાગ / નૈષધીયચરિતમ् સર્ગ – ૧ / કાવ્યદોષા: ભામહ / નાટ્યશાસ્ત્ર

Time : 3 Hours]

[Max. Marks : 100

સૂચના : (1) જમણી બાજુ ગુણ દર્શાવેલ છે.

Instructions : Figures to the right indicate marks.

(2) બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

All questions carry equal marks.

(3) જે વિકલ્પ પસંદ કરો તે સ્પષ્ટ જણાવો.

Mention clearly the options you attempt.

1. (અ) ગદ સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ જણાવી, તેમાં કાદમ્બરીનું સ્થાન સ્પષ્ટ કરો. 10

અથવા

‘કથા’ અને ‘આખ્યાયિક’ ના લક્ષણો જણાવી, કાદમ્બરીનો સાહિત્ય પ્રકાર સ્પષ્ટ કરો.

(બ) વિવેચનાત્મક નોંધ લખો : (ગમે તે બે)

(1) બાણ ભણ્ણનું કલ્પના વૈભવ

(2) જાબાલ મુનિના આશ્રમનું વર્ણન

(3) બાણ ભણ્ણનું જીવન

(4) કાદમ્બરીના કથામુખભાગનો સાર

2. (અ) નીચેના ગદખંડોમાંથી ગમે તે બેનો અનુવાદ કરો : 10

(1) દેવ ! દ્વારાસ્થિતા સુરલોકમારોહતસ્ત્રિશાઙ્કોરિવ કુપિતશતમુખ હુંકાર નિપાતિતા રાજલક્ષ્મીર્દક્ષિણા-પથાદાગતા ચાણ્ડાલ કન્યકા પદ્જરસ્થં શુકમાદાય દેવં વિજાપયતિ । સકલ ભુવનતલ સર્વ રત્નાનામુદ્ધિરિવેક ભાજનં દેવો વિહંગમશ્ચાયમાશ્ર્ચયભૂતો નિખિલ ભુવનતલ રત્નમિત્રકૃત્વા દેવબાદ મૂલમાદાયાગતાહમિચ્છામિ દેવ દર્શન સુખમનુભવિતુમિતિ । એતદાકર્ણ્ય દેવ: પ્રમાણમ् । ઇત્યુક્તવાવિરરામ ।

(2) સમુપજાતવિસ્મયસ્ય ચાભૂન્મનસિ મહીપતે: । અહો વિધાતુરસ્થાને રૂપનિષ્ઠાદન પ્રયત્ન: । તથા હિ । યદિ । નામેયમાત્મરૂપોપહસિતા શેષ રૂપસમ્પદુત્પાદિતા કિર્મર્થમપગત સ્પર્શ સંભોગ સુખે કૃતં કુલે જન્મ । મન્યે ચ માતઙ્ગજાતિ સ્પર્શદોષ ભયાદસૃશર્તયમુત્પાદિતા પ્રજાપતિના, અન્યથા કથમિયમ કિલાષ્ટતા લાવણ્યસ્ય । નહિ કરતલસ્પર્શકલોશિતા નામવયવાનામીદૃશી ભવતિ કાન્તિ: ।

- (3) राजा तु तां श्रुत्वा संजातविस्मयः सहर्षमासन्नवर्त्तिनमति महार्हेमासनोपविष्टममर गुरुमिवाशेष  
नीतिशास्त्र पारगमति वय समग्रजन्मानमस्तिल मन्त्रिमण्डले प्रधानममात्यं कुमार पालितनामानमब्रवीत्  
— श्रुता भवदिभरस्य विहङ्गमस्य स्पष्टता वर्णाच्चारणे स्वरे च मधुरता । प्रथमं तावदिदमेव  
महदाश्चर्यम् संकीर्ण प्रविभागामभिव्यक्तमात्रानुस्वार स्वर संस्कार योगां विशेष संयुक्तां  
यद्यमतिपरिस्फुटाक्षरांगिरमुदीरयति ।
- (4) प्रायेणाकारणमित्राण्यति करुणाद्राणि च सदा खलु भवन्ति सतां चेतांसि । यतः स मां  
तदवस्थामालोक्य समुपजातदयः समीपवर्तिनमृषिकुमारकमन्यतमब्रवीत् । अयं कथमपि  
शुकशिशुरसंजातपक्ष पुट एव तरुशिखरादस्मात्परिच्युतः । श्येन मुख परिप्रष्टेन वानेन भवितव्यम् ।  
तथा हि । अतिदीवीयस्तया प्रपातस्याल्प शेषजीवितोयमार्मालितलोचनो मुहुर्मुहुर्मुखेन पतति  
मुहुर्मुहुरत्युल्वणं श्वसित मुहुर्मुहुश्चञ्चुपुटं विवृणोति । न शक्नोति शिरोधरां धारयितुम् ।

(भ) ससन्दर्भ समजावो : (गमे ते बे)

10

- (1) अकारणाविष्कृतवैरदारुणादसञ्जनात्कस्य भयं न जायते ।  
(2) द्विजो जगद्गीतगुणोऽग्रणीः सताम् ।  
(3) हिरण्यगर्भो भुवनाण्डकादिव क्षपाकरःक्षीरमहार्ण वादिव ।

3. (अ) नीचे आपेला श्लोकों अनुवाद करो : (गमे ते बे)

6

- (1) अमुष्य विद्या रसनाग्रनर्तकी त्रयीवनीताङ्ग गुणेन विस्तरम् ।  
अगाहताष्टादशतां जिगीषयानवद्यद्वीपपृथग्जयश्रियाम् ॥  
(2) यथोद्यमानः खलु भोगभोजिना प्रसह्य वैरोचनिजस्य पत्तनम् ।  
विदर्भजाया मदनस्तथा मनोऽनलावरुद्धं वयसैव वेशितः ॥  
(3) निजा मयुरवा इव तिग्मदीधिति स्फुटारविन्दाङ्गिकत पाणिपङ्कजम् ।  
तमश्ववारा जवनाश्वयायिनंप्रकाशरूपामनुजेरामन्वयुः ॥  
(4) रथाङ्गभाजा कमलानुषड्गणाशिलीमुखस्तोम सखेनशाङ्गण  
सरोजिनीस्तम्बकदम्बकैतवान्तृणाल शेषाहि भुवाऽन्वयायि यः ॥

(भ) ससन्दर्भ समजावो : (गमे ते अेक)

4

- (1) विधिरेककचक्रचारिणं किमुर्निर्मित्सति मान्मथंरथम् ।  
(2) क्षितिमण्डलमण्डनायितं नगरं कुण्डनमण्डनो ययौ ॥  
(५) ‘नैषधीयचरितम्’ महाकाव्यनो सार ज्ञावी, कवि हर्षना पांडित्य विशे नोंध लभो.

10

#### अथवा

‘महाकाव्य’ना लक्षणो ज्ञावी, ‘नैषधीयचरितम्’नुं भहाकाव्य तरीके भूत्यांकन करो.

4. (अ) ‘काव्यालंकार’मां निरुपित काव्यदोषाः ना नाम आपी, गमे ते बे दोष विशे विस्तारथी समजावो. 10

#### अथवा

‘वाचां दोषं चतुर्विधम्’ विस्तारथी समजावो.

(भ) विस्तारथी समजावो : (गमे ते बे)

10

- (1) विपर्यय दोषः ।  
(2) अपकर्मदोषः ।  
(3) यति भ्रष्ट दोषः ।

5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં આપો :

20

- (1) નાટ્યશાસ્ત્રની રચના કોના નિર્દ્દશથી કોના દ્વારા કરવામાં આવી ?
  - (2) નાટ્યવેદની રચના સમયે ચારે વેદોમાંથી શું લેવામાં આવ્યું ?
  - (3) નાટ્યપ્રયોગ વખતે શું-શું ધ્યાનમાં રાખવું જોઈએ ?
  - (4) દૈત્યોના અગ્રેસરે શું કર્યું ? તેનું નામ જણાવો.
  - (5) નાટ્યની ઉપયોગીતા ટૂંકમાં જણાવો.
  - (6) નાટ્ય અંગે ભગવાન શંકર શું જણાવે છે ?
  - (7) ‘દ્રશ્ય’ અને ‘શ્રવ્ય’ કોના વિભાગ છે ? તેમાં શું હોય છે ?
  - (8) ‘ક્રીડનીયક’ કોને કહેવામાં આવે છે ? શા માટે ?
  - (9) નાટ્યગૃહની સાચવણી કોને સોંપવામાં આવી ?
  - (10) માયા દ્વારા અસુરોએ નાટ્યપ્રયોગમાં શું કર્યું ?
-

